



**PAS-001-001587**

Seat No. \_\_\_\_\_

**B. A. (Sem. 5) (CBCS) Examination**

October / November - 2018

**Psychology : Paper - XIII**

(*Physiological Psychology*)

(*Old Course*)

**Faculty Code : 001**

**Subject Code : 001587**

Time : 2 Hours]

[Total Marks : 70

સૂચના : બધા પ્રશ્નો ફરજિયાત છે.

- |             |  |    |
|-------------|--|----|
| ૧           | શરીરલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો.   | ૧૪ |
| <b>અથવા</b> |  |    |
| ૧           | શરીરલક્ષી મનોવિજ્ઞાનનું અભ્યાસક્ષેત્ર સમજાવો.                  | ૧૪ |
| ૨           | આંતરિક વાતાવરણ એટલે શું ? ઉત્સેચકોની વર્તન પર થતી અસરો વર્ણવો. | ૧૪ |
| <b>અથવા</b> |  |    |
| ૨           | કંઠ ગ્રંથિ અને ભસ્તિજી ગ્રંથિ વિગતવાર સમજાવો.                  | ૧૪ |
| ૩           | ચેતાકોષની રચના અને કાર્ય વિગતવાર સમજાવો.                       | ૧૪ |
| <b>અથવા</b> |  |    |
| ૩           | મોટા મગજની રચના અને તેનાં વિભાગો વિસ્તૃત સમજાવો.               | ૧૪ |
| ૪           | પ્રજીવકોનો અર્થ આપી, વર્તન પર થતી અસરો વર્ણવો.                 | ૧૪ |
| <b>અથવા</b> |  |    |
| ૪           | સાંવેદનિક પ્રક્રિયા તંત્ર સમજાવો.                              | ૧૪ |
| ૫           | ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે)                                     | ૧૪ |
|             |  |    |
| (૧)         | (૧) પરિધવતી ચેતાતંત્ર  |    |
| (૨)         | (૨) શરીરલક્ષી મનોવિજ્ઞાનનું મહત્વ                              |    |
| (૩)         | (૩) ચ્યાપચયની કિયા   |    |
| (૪)         | (૪) ચેતાપ્રવાહનું સ્વરૂપ.                                      |    |

## ENGLISH VERSION

**Instruction :** All questions are compulsory.

- 1** Give the definition of physiological psychology and describe its nature. **14**

**OR**

- 1** Explain the scope of physiological psychology. **14**

- 2** What is internal environment ? Discuss the effects of enzymes on behaviour. **14**

**OR**

- 2** Explain in detail the thyroid gland and pituitary gland. **14**

- 3** Describe in detail the structure and functions of neuron. **14**

**OR**

- 3** Explain in detail the structure of brain and different parts of brain. **14**

- 4** Give the meaning of vitamins. Discuss the effects of vitamins on behaviour. **14**

**OR**

- 4** Explain the sensory mechanism. **14**

- 5** Write short notes : (any **two**) **14**

- (1) Peripheral nervous system
- (2) Importance of physiological psychology
- (3) Metabolism system
- (4) Nature of nerve impulse.